



## Market News

આજના કારોબારી સત્રના અંતિમ દિવસે ભારતીય બજાર ઉતાર-ચઢાવની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 15700 ની નીચે બંધ થયા જ્યારે સેન્સેક્સે 52344 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 15,450.90 સુધી તૂટ્યો, તો સેન્સેક્સ 52,586.41 સુધી પહોંચ્યો હતો.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.70 ટકા લપસીને 22,238.21 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.89 ટકાની નબળાઈની સાથે 24,648.83 પર બંધ થયા છે.

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો નબળાઈ સાથે બંધ થતો જોવા મળી રહ્યો છે. 1 ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 21 પૈસાથી વધીને 73.86 પર બંધ થયો છે. જ્યારે ગુરુવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 74.07 બંધ થયો હતો.

પેમેન્ટ સોલ્યુશન્સ કંપની Paytm ને ચલાવા વાળી One97 એક ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) ના દ્વારા ફંડ એકઠા કરવાના અપ્રવલ માટે 12 જુલાઈના એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) બોલાવી શકે છે. Paytm ની યોજના IPO ના દ્વારા લગભગ 12,000 કરોડ રૂપિયા એકઠા કરવાની છે.

ડાયગ્નોસ્ટિક્સ સર્વિસિસ કંપની Thyrocareને લગભગ 7,000 કરોડ રૂપિયામાં ખરીદવા માટે pharmEasy અંતિમ તબક્કામાં વાતચીત કરી રહી છે. આ ડિવેલપમેન્ટની જાણકારી રાખતા સૂત્રોએ મનીકંટ્રોલને બતાવ્યું કે ડીલની જાહેરાત જલ્દી જ કરી શકે છે. PharmEasyની પેરન્ટ કંપની API Holdingની IPO લાવવાની યોજના

છે. API Holdingએ હાલમાં PharmEasyની રાહત ફર્મ મેડલાઇફને એક્વાયર કરી હતી. મનીકંટ્રોલે ગયા મહિને રિપોર્ટ આપ્યો હતો કે API Holding આ ફાઇનેન્શિયલ વર્ષમાં IPOના દ્વારા 1.2 અરબ ડોલર એકત્ર કરી શકે છે.

Thyrocareના પ્રમોટરો તેમનો હિસ્સો વેચી શકે છે, જેનાથી કંપનીના શેરહોલ્ડરો માટે એક ઓપન ઓફર આવી શકે છે. પ્રમોટર્સના પાસે માર્ચના અંતમાં કંપનીમાં 66.14 ટકા હિસ્સો છે.

કોટક લાઈફ ઈન્શ્યોરન્સ (Kotak Life Insurance) ના પોતાના શેરહોલ્ડર્સ અકાઉન્ટમાં કોરોના વાયરસ મહામારીના કારણે 225 થી 275 કરોડ રૂપિયાની ખોટ થઈ શકે છે. ખરેખર, કોટક લાઈફને આ નુકસાન કોરોના ના વધતા કેસ અને થયેલ મૃત્યુ ને કારણે ઈન્શ્યોરન્સ ક્લેમ અને પ્રોવિઝન્સ વધવાના કારણ રહેશે.

કોટક મહિન્દ્રા બેન્કે સ્ટોક એક્સચેન્જના પોતાની રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું કે કોટક લાઈફ કંપનીના જણાવ્યું છે કે ઈન્શ્યોરન્સ ક્લેમની રકમ જેટલી ઉમ્મીદ કરવામાં આવી રહી હતી તેનાથી વધારે થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 16 જુનના કોટક મહિન્દ્રા બેન્કના બોર્ડની બેઠક થઈ હતી, જેમાં વધેલા ક્લેમના કારણે 225 થી 275 કરોડ રૂપિયાની ખોટ થવાનું અનુમાન લગાવામાં આવ્યું.

Paytm IPO: પેમેન્ટ સર્વિસ કંપની પેટીએમએ જેપી મોર્ગન સહિત 4 બેન્કોને ઇશ્યૂ માટે હાયર કર્યા છે. આ 4 બેન્કો જેપી મોર્ગન, ગોલ્ડમેન સેક્સ, icici સિક્યોરિટીઝ અને મોર્ગન સ્ટેનલી છે. આ બાબતની જાણકારી રાખતા લોકોએ જણાવ્યું હતું કે પેટીએમએ આ ચાર બેન્કોને ઇશ્યૂ માટે હાયર કર્યા છે.

## Results & Corporate Action

Result Calendar	
Date	Company Name
21 Jun 2021	NAUKRI
22 Jun 2021	BEL, NMDC
23 Jun 2021	APOLLOHOSP
24 Jun 2021	ASHOKLEY, ONGC,
25 Jun 2021	IGL



Corporate Action	Company Name	Type & Percentage	Record Date	Ex-Date
Bonus	<u>Aarti Ind</u>	Bonus Ratio (1:1)	23-06-2021	22-06-2021
SPLITS	<u>G G Engineering</u>	Old Fv 10 New Fv 2	~	21-06-2021
SPLITS	<u>Inventure Grow</u>	Old Fv 10 New Fv 1	~	24-06-2021
DIVIDEND	<u>Supreme Ind</u>	Final (850%)	~	21-06-2021
DIVIDEND	<u>Sky Industries</u>	Final (10%)	~	21-06-2021
DIVIDEND	<u>Info Edge</u>	interim (80%)	22-06-2021	21-06-2021
DIVIDEND	<u>Bhansali Eng</u>	Final (100%)	~	22-06-2021
DIVIDEND	<u>Vinati Organics</u>	Final (600%)	~	24-06-2021
DIVIDEND	<u>Torrent Power</u>	Final (55%)	25-06-2021	24-06-2021
DIVIDEND	<u>Adani Ports</u>	Final (250%)	25-06-2021	24-06-2021
DIVIDEND	<u>Adani Total Gas</u>	Final (25%)	25-06-2021	24-06-2021
DIVIDEND	<u>Vimta Labs</u>	Final (100%)	28-06-2021	25-06-2021
DIVIDEND	<u>Supreme Petro</u>	Final (125%)	~	25-06-2021

### Nifty Spot in Last Week:-

ઉપરમાં ૧૫૮૦૧.૬૦ અને નીચામાં ૧૫૪૫૦.૬૦ નો ભાવ જોવા મળ્યો હતો.



NIFTY WEEKLY CHART



BANKNIFTY WEEKLY CHART

### Nifty Spot in Upcoming Week:-

નીચામાં ૧૫૪૦૦ support છે ઉપરમાં ૧૫૮૦૦ નું resistance છે.

### Bank Nifty in Upcoming week:-

નીચામાં ૩૩૮૦૦ નો support છે ઉપરમાં ૩૪૮૦૦ નું resistance છે.

## Recommendation for next week

Serial No.	Stock Name Cash segment	Above Below / Add HOLD	CMP as on 19.06.2021	Trail SL	Buy Stop loss	Sell Stop loss	Target
1	ROHLTD(BUY)	ABOVE 93.30	87.35		85		132
2	BIOCON (BUY)	ABOVE 402	398		389		425
3	SUNTV (BUY)	AROUND 515-17	549		499		600





# Currency Market (Cash Levels)

**USDINR:** ઘટાડે ૭૩.૪૦ ના S1 થી ખરીદી કરી શકાય ઉપરમાં ૭૪.૫૦ થી ૭૫.૦૦ સુધી નો ભાવ આવી શકે.



**GBPINR:** ઘટાડે ૧૦૧.૮૦ ના S1 થી ખરીદી કરી શકાય ઉપરમાં ૧૦૩.૫૦ થી ૧૦૪ સુધી નો ભાવ આવી શકે.



**EURINR:** : ઉછાળે ૮૯.૦૬ ના S1 થી વેચાણ કરી શકાય નીચામાં ૮૭.૫૦ સુધી નો ભાવ આવી શકે.



**JPYINR:-** ઘટાડે ૬૬.૪૦ ના S1 થી ખરીદી કરી શકાય ઉપરમાં ૬૭.૬૦ સુધી નો ભાવ આવી શકે.

Currency CASH LEVEL	DEMAND ZONE LEVEL		CLOSE	SUPPLY ZONE LEVEL	
	D2	D1		S1	S2
<b>USDINR</b>	73.00	73.50	73.95	74.50	75.00
<b>GBPINR</b>	101.50	102.00	102.77	103.30	104.00
<b>EURINR</b>	87.00	87.50	88.09	89.00	89.50
<b>JPYINR</b>	66.00	66.50	67.13	67.50	68.00

## Currency Corner

Premium / Discount (USD/ INR) Based on Forward Rates	
Duration	Premium
One month Forward	0.25
Three month Forward	0.55
Six month	1.35
One year	3.05

RBI reference Rates	
Currency	Rates
USD	74.14
GBP	103.03
Euro	88.25
100 Yen	67.35

## 10 પૈસાની સારી ટેવ કે જે જીવનને બદલી શકે છે

વર્ષ 2020 અઘરું હતું (COVID-19) વર્ષ 2021 માં બીજી તરંગ વધુ જીવલેણ લાગે છે. આ સમય દરમિયાન, લોકોને સમજાયું છે કે સારી પૈસાની ટેવ બચાવનાર સાબિત થઈ શકે છે.

જ્યારે પણ માનવતા તાણમાં આવે છે, ત્યારે લોકો મૂળભૂત બાબતોનો આશરો લે છે. ખોરાક, આશ્રય, આરોગ્ય, કુટુંબ પ્રાધાન્યતા લે છે. પરંતુ આ મહત્વપૂર્ણ બાબતોને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે, લોકોને પૂરતા પૈસાની જરૂર છે.

પૈસા કમાવવા લોકો નોકરી અને ધંધો કરે છે. પરંતુ આ પૈસા પણ ચોક્કસ રીતે ખર્ચ કરવો જોઈએ.

સામાન્ય રીતે, લોકો તેમની બધી આવક ખોરાક, બિલ, ફી, મનોરંજન, મુસાફરી વગેરે પર ખર્ચ કરે છે આ પણ જરૂરી વસ્તુઓ છે, પરંતુ તે સંપૂર્ણ સૂચિ નથી. થોડા વધુ વિશિષ્ટ ખર્ચ અને મુખ્ય સમાવેશ કરવો જરૂરી છે. અમે આ લેખમાં તે ખર્ચના મુખ્ય અને વધુ વિશે વાત કરીશું.

જો આપણે આપણા ખર્ચને નિયંત્રણમાં રાખી શકીએ, તો તે પૈસાની સારી ટેવ પાડવા માટે તૈયાર કરે છે. આ આદતો આપણા હાથમાં ખર્ચ પર નિયંત્રણ આપી શકે છે:

### 1. બધા ખર્ચની નોંધણી શરૂ કરો

બધી સારી ફાઇનાન્સ ટેવના મૂળિયા ખર્ચના નિયંત્રણમાં હોય છે. ખર્ચ કેવી રીતે નિયંત્રિત કરવો? પ્રથમ પગલું એ દરેક ખર્ચની નોંધણી શરૂ કરવાનું છે. આવનારા વર્ષો માટે કોઈએ આ ડેટા-એન્ટ્રી કાર્ય ફરીથી અને ફરીથી કરવું પડશે. તે સરળ નથી. બધી ટેવોમાંથી, તે સૌથી મુશ્કેલ છે. પરંતુ તેની અસરકારકતા પણ સાબિત થાય છે.

### 2. પ્રથમ બજેટ પછી ખર્ચ કરો

આપણે જાણીએ છીએ કે ખર્ચ નિયંત્રણ જરૂરી છે. પરંતુ તે કેવી રીતે ફૂલપૂફ રીતે કરવું? તેનો અમલ બીજી ટેવ દ્વારા શક્ય છે. કેવી રીતે? દર વર્ષે એક વખત ખર્ચ બજેટ તૈયાર અને અપડેટ કરીને. દરેક ખર્ચ મુખ્ય માટેનું બજેટ મૂલ્ય અમને સંદર્ભ આપે છે. બજેટ સંખ્યાથી આગળ ખર્ચ કરવાથી વધારે ખર્ચ કરવામાં આવશે.

### 3. સમીક્ષા ખર્ચ

ઉપરોક્ત બે પગલામાં કરવામાં આવેલી બધી મહેનત તેની સમીક્ષા કર્યા વિના અર્થહીન બની જાય છે. દર છ મહિનામાં એકવાર તમારા ખર્ચના અહેવાલની સમીક્ષા કરવાની ટેવ બનાવો. આ ક્વાયત કરવા પાછળનું મોટું લક્ષ્ય વધારે ખર્ચ અટકાવવાનું છે. ખર્ચ અહેવાલની સમીક્ષા કરવાથી ભરાતા મુખ્ય ખર્ચને પ્રકાશિત કરવામાં આવે છે.

### 4. દેવાની ચૂકવણી

હોમ લોન અથવા એજ્યુકેશન લોન જેવા બેંક દેવાં મોટાભાગે મોટા મૂલ્યો હોય છે. તેથી તે ચૂકવણી માટે સમય લે છે. શૂન્ય પર લોન લાવવા માટે ફક્ત ઇએમઆઈ ચૂકવણી પર આધાર રાખવો એ ધીમી પ્રક્રિયા છે. તેને ઝડપી બનાવવા માટે, આપણે લોન પૂર્વ ચૂકવણીની આદત બનાવવી જોઈએ. આપણે દર વર્ષે ઓછામાં ઓછી એક પૂર્વ ચૂકવણી કરવાનો પ્રયાસ કરવો જ જોઈએ.

### 5. સમયસર બીલ ચૂકવો

અમને સતત આવર્તન સાથે બીલ પ્રાપ્ત થાય છે. તેથી તેને વ્યવસ્થિત રાખવાનું શક્ય છે. પરંતુ આપણે ઘણી વાર તેને ચીરીથી સંભાળીએ છીએ. કેમ? કારણ કે આપણે સમયસર તેમને ચૂકવણી કરવાનું ભૂલી જઈએ છીએ. સમાધાન શું છે? પ્રથમ, તમારા બધા બિલની લિસ્ટ બનાવો અને પછી તેમને વર્ગીકૃત કરો. તે કેવી રીતે કરવું? તેને તેમની ઘટનાની આવર્તન (માસિક, ત્રિમાસિક, વાર્ષિક) ના આધારે પડાવ કરો. ઉપરાંત, તેમની છેલ્લી નિયત તારીખ પણ નોંધો. દર મહિને એકવાર આ સૂચિની સમીક્ષા કરવાની ટેવ રાખો અને તમે જે કરો તે પ્રમાણે ચૂકવણી કરો.

### ખરાબ સમય માટે તૈયાર

આગળનાં પગલામાં, અમે સંભવિત નાણાકીય કટોકટીઓ માટે પોતાને તૈયાર રાખવાનો પ્રયત્ન કરીશું. તે તબીબી અને બિન-તબીબી હોઈ શકે છે. તે જાણીતી હકીકત છે કે જ્યારે કટોકટી આવે છે ત્યારે પૈસા સતત બહાર વહી જાય છે. આપણે તેને રોકી શકતા નથી, પરંતુ આપણે આવા સમય માટે પોતાને તૈયાર કરી શકીએ છીએ.



તેને નીચેની બે ટેવોથી પ્રાપ્ત કરો:

#### 6. ઇમર્જન્સી કેશ રાખો

આપણે નિયમિત રીતે નાની નાની કટોકટીનો સામનો કરતા રહીએ છીએ. આ જીવનની મુખ્યત્વે બિનઆયોજિત અને અનિવાર્ય ઘટનાઓ છે. તેમાંના મોટાભાગના લોકો પૈસાની વહેણની માંગ કરે છે. પૈસા આપણા સંચિત ઇમર્જન્સી ફંડમાંથી આવવા જોઈએ. તમારી માસિક આવકનો 1.5% કટોકટી વોલેટમાં મૂકવાની ટેવ શરૂ કરો. સમય સાથે વોલેટનું કદ વધવા દો.

#### 7. કુટુંબનો વીમો રાખો

જ્યારે ઇમર્જન્સી મોટી હોય ત્યારે આપણું રોકડ વોલેટમાં અપૂરતું પુરવાર થઈ શકે છે. ત્યાં જ વીમા આયોજન મદદ કરશે. લાક્ષણિક ભારતીય પરિવારે આ વીમાને હાથમાં રાખવું આવશ્યક છે: જીવન, આરોગ્ય અને મોટર વીમો.

જીવનનું કદ અને આરોગ્યના આવરણ પૂરતા હોવા જોઈએ. માત્ર નામના માટે એક નાનો કવર ખરીદવામાં મદદ મળશે નહીં. લાઇફ કવર અને મેડિકલ કવરના કદની સમીક્ષાની એક આદત બનાવો, દર બે વર્ષે એકવાર તમારી જરૂરિયાત. વય અને જીવનધોરણ સાથે, વીમાની રકમ વધવી આવશ્યક છે. ખાતરી કરો કે તમારી વીમા પોલિસિ સમીક્ષા મુજબ આવશ્યક કવર પ્રદાન કરે છે.

બચાવો અને રોકાણ કરો

ઉપરનાં સાત (7) પગલામાં આપણે જે કર્યું તે હતું વધુ પૈસા બચાવવા માટેની અમારી ક્ષમતા વધારવી. જો બચત વધુ હોય, તો અમે રોકાણ કરી શકીએ છીએ અને તેને ઝડપથી વિકસિત કરી શકીશું. આખરે બધું જ રોકાણમાં ઉકળે છે. આપણે પોતાને પૈસામાં રોકાણ કરવાની ક્ષમતા આપવા માટે સારી ટેવો બનાવી રહ્યા છીએ.

#### 8. ટેક્સ બચાવો

આપણી સંપત્તિમાં એક મોટો લિક એ છે કે 'આવકવેરો.' પરંતુ આપણી કરનો ભાર ઘટાડવાની રીત છે. ટેક્સ સ્લેબના આધારે કોઈની આવકવેરા જવાબદારી વિશે જાગૃત થવું એ પ્રથમ પગલું છે. આગળનું પગલું ટેક્સ બચતનાં સાધનો ખરીદવાનું છે. આ ખર્ચ પછી "કર કપાત" માટે પાત્ર બનશે. બદલામાં, તેઓ અમારી કર જવાબદારી ઘટાડશે. આપણે મહત્તમ ટેક્સ કપાત શક્ય હોવાનો દાવો કરવાની આદત બનાવવી જોઈએ.

## 9. નાણાકીય લક્ષ્યો ઓળખો

પગલું # 8 સુધી અમે જે કર્યું છે તે અમારા બેંક ખાતામાં પૂરતી રોકડ થાપણો (બચત) ની ખાતરી કરશે. નિષ્ક્રિય રોકડનું રોકાણ કરવું વધુ સારું છે. પરંતુ તે પહેલાં, આપણે જાણવું જ જોઈએ કે આપણે પૈસા કેમ રોકાણ કરી રહ્યા છીએ. તેનો અહેસાસ કરવા માટે, આપણે જીવનના તમામ નાણાકીય લક્ષ્યો ઓળખવા જોઈએ. તે આપણી નાણાં સંબંધિત પ્રવૃત્તિઓને ચોક્કસ દિશા આપશે.

આ ખ્યાલમાં, આપણે જીવનની કોઈ પણ આગામી (મોટી અથવા નાની) આવશ્યકતાઓની સૂચિ બનાવવાની ટેવ બનાવવી જોઈએ. એકવાર પ્રવૃત્તિ સૂચિબદ્ધ થઈ જાય, પછી તેની નાણાકીય કિંમતની દ્રષ્ટિએ તેને પ્રમાણિત કરો. ઉદાહરણ: બાળકના ઉચ્ચ શિક્ષણ માટે આજથી દસ વર્ષ પછી રૂ .૨ Lakh લાખનો ખર્ચ થઈ શકે છે.

## 10. રોકાણ પોર્ટફોલિયો બનાવો

આપણે સંચિત બચતનું રોકાણ કરવું જોઈએ. આગળ વધવા માટેનું શ્રેષ્ઠ પગલું એ બે અલગ અલગ રોકાણ પોર્ટફોલિયો બનાવવાનું છે. પ્રથમ, નિવૃત્તિ ના સમયે બચત ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બીજો એક અન્ય તમામ લક્ષ્યોને પૂરો કરવો જોઈએ.

બે વિભાગ કેમ? કારણ કે નિવૃત્તિને અન્ય લક્ષ્યો સાથે મિશ્રિત કરવાથી મૂંઝવણ થઈ શકે છે. નિવૃત્તિ યોજના કરતાં તાત્કાલિક નાણાકીય લક્ષ્યો વધુ તાત્કાલિક દેખાશે. તેથી નિવૃત્તિ અવગણવામાં આવે છે, અને ધ્યાન અન્યત્ર છે. આ સંદર્ભમાં, બે અલગ અલગ પોર્ટફોલિયોના ચુક્તિ કરી શકે છે.

એકવાર આપણે પૂરતી બચત કરીશું અને ભવિષ્યના લક્ષ્યો વિશે પણ જાણ કરીશું, પછી આપણે રોકાણની વ્યૂહરચનાને અનુસરવા તૈયાર થઈશું. બહુમતી માટે, મ્યુચ્યુઅલ ફંડ્સને તેમના પ્રાધાન્ય રોકાણ વાહન તરીકે ઉપયોગ કરવામાં મદદ કરશે. પરંતુ એવા લોકો માટે કે જેઓ વધુ જોખમ લઈ શકે છે તેમના પોર્ટફોલિયોમાં સ્ટોક્સ શામેલ કરી શકે છે.

### HEAD OFFICE

B/230-231, International Trade Center, Majura Gate, Ring Road, Surat-2.(Guj.) India Ph: 0261- 40 60 750, 246 27 90  
Fax : 0261-246 27 91 www.markethubonline.com E-Mail : info@markethubonline.com

**IA SEBI Registration no.:INA000005333**

#### Disclaimer:

We do not represent that information provided by us is accurate or complete and it should not be relied upon as such. The advice provided here is just for knowledge purpose only. The user assumes the entire risk of any use made or not made of this information.

INVESTMENT IN EQUITY, MUTUAL FUND, EQUITY, CURRENCY & COMMODITY DERIVATIVES IS SUBJECT TO RISK. WE ARE DISTRIBUTOR OF MUTUAL FUND.

Client should read the Risk Disclosure Document (RDD) & Do's and Don'ts issued by SEBI & relevant exchanges before investing.